



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૧૦/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૭૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૨૪૭ લીટર દેશી દારૂ, ૧૧૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૮ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૭ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૭૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૭૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૭૩/૧૮

અમરાઈવાડી: ઉમેશ સુરેશભાઈ ગુપ્તા (રહે.વિનાયકપાર્ક સોસાયટી નાની કેનાળ રોડ વ્રજભુમી સોસાયટી પાસે વસાલ) એ તા.૨૨/૧૦/૧૮ નારોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૧૮/૧૦/૧૮ કલાક ૧૦/૦૦ થી ૧૦/૩૦ વાગ્યા દરમિયાન સ્વસ્તિક ચાર રસ્તા જોગણીમાતાના મંદિર પાસે મહાલક્ષ્મી કોલ્ડ્રીકના ગોડાઉનમાંથી સોનાની વિટી કિંમત રૂપિયા ૧૨,૦૦૦/-, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૨,૦૦૦/-મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એસ.મકવાણા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૭૪/૧૮

નવરંગપુરા: દિપેશભાઈ ગોવિંદભાઈ દેસાઈ (રહે.તુલસી બંગ્લોઝ કેશવબાગ પાર્ટી પ્લોટ સામે સાયન્સ સીટી રોડ સોલા) તા.૨૦/૧૦/૧૮ સાંજના ૭/૧૫ વાગ્યાના સુમારે નવરંગપુરા સી.જી.રોડ ફોર્ડ શો રૂમ નજીકથી પોતાની કાર ચલાવી પસાર થતા હતા ત્યારે બે પુરૂષો દિપેશભાઈ પાસે આવી દિપેશભાઈની ગાડીમાંથી ઓઇલ નીકળે છે તેમ કહી દિપેશભાઈની નજર ચુકવી ગાડીમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ દિપેશભાઈ દેસાઈએ તા.૨૨/૧૦/૧૮ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ટી.ચૌધરી ચલાવે છે.

કાલુપુર: હેમંતભાઈ હીરાલાલ મહેતા (ઉ.વ.૬૨) (રહે. બિનોરી સોલીટર સાબો સેંટર પાછળ સાઉથ બોપલ) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૧૦/૧૮ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે કાલુપુર રેલ્વે સ્ટેશન ઇનગેટ સામે હેમંતભાઈની નજર ચુકવી પેન્ટના ખીસામાંથી રોકડ રૂપિયા ૮૫૦૦/- તથા અમેરીકન ડોલર ૫૦૧ અજાણી વ્યક્તિએ ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એચ.કછોટ ચલાવે છે.

શાહીબાગ: ડો.રીની ડો/ઓ રાજેશ બુધ્ધદેવ (ઉ.વ.૨૭) (રહે.ડી/૪૦૩ ફેજ-૧ ન્યુ પી.જી.હોસ્ટેલ સિવિલ હોસ્પિટલ) એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૧૦/૧૮ કલાક ૭/૪૫ થી કલાક ૧૨/૪૫ વાગ્યા દરમિયાન કામવાળા બેન નામે પદમીનીબેન બાસાહેબ કરાડેએ પોતાના રહેણાંક માંથી લેપટોપ ૩૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૪,૫૦૦/- મળી કુલ રૂપિયા ૩૯,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.ડાભી ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૦૭૫/૧૮

સોલા હાઈકોર્ટ: (૧) સરલાબહેન તે વિધવા રાજુભાઈ કાન્તિલાલ સગર (રહે.સ્વસ્તિક પેલેસ સિલ્વર સ્ટાર પાસે બેંક ઓફ બરોડાની ગલીમા ચાંદલોડીયા) તા.૨૨/૧૦/૧૮ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે સિલ્વર સ્ટાર ચાર રસ્તાની પાસે આવેલ મુરલીધર ડેરી આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સરલાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સરલાબહેન સગરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એસ.સ્વામી ચલાવે છે.

(૨) ગાયત્રીબહેન ચંદુભાઈ પટેલ (રહે.મધુવન બંગ્લોઝ કારગીલ પેટ્રોલપંપ પાછળ આદિત્વ એલીઝસ ફ્લેટની બાજુમા સોલા) તા.૨૧/૧૦/૧૮ સવારના ૬/૪૫ વાગ્યાના સુમારે સોલા રત્નમ ફ્લેટ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સરલાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ગાયત્રીબહેન પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એસ.સ્વામી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૦૭૬/૧૮

ચાંદખેડા: હિતાંશુ સ/ઓ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૧૪) (રહે.શ્યામ બંગ્લોઝ વિભાગ-૨ આઇ.ઓ.સી.રોડ ચાંદખેડા) એ અગમ્ય કારણસર તા.૨૨/૧૦/૧૮ નારોજ પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અક્સ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી સુરેશભાઈ મંગળભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.